

Seat No. : _____

MC-114

March-2022

B.A., Sem.-I (New)

CC-101 : Economics

(Elements of Economics – I)

Time : 2 Hours]

[Max. Marks : 50

વિભાગ – I

નીચેના આઠ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ લખો :

1. પ્રો. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા ટીકાત્મક રીતે ચર્ચો. 14
2. તુષ્ટિગુણ એટલે શું ? તુષ્ટિગુણના વિવિધ લક્ષણો અને પ્રકારો વિસ્તારથી સમજાવો. 14
3. માંગ વિધેયનો ખ્યાલ સમજાવી માંગના નિર્ણાયક પરિબલોની ચર્ચા કરો. 14
4. માંગનું વિસ્તરણ- સંકોચન અને વધારો-ઘટાડો આકૃતિઓની મદદથી સમજાવો. 14
5. પુરવઠાનો નિયમ આકૃતિની મદદથી સમજાવી તેના અપવાદો ચર્ચો. 14
6. પુરવઠો એટલે શું ? પુરવઠા વિધેયનો ખ્યાલ સમજાવી પુરવઠાનાં વિવિધ નિર્ણાયક પરિબલો ચર્ચો. 14
7. બજાર એટલે શું ? બજારનાં વિવિધ લક્ષણો અને કાર્યો ચર્ચો. 14
8. બજાર કિંમત એટલે શું ? બજાર કિંમતનું નિર્ધારણ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. 14

વિભાગ-II

8

9. બહુવૈકલ્પિક પ્રશ્નો (કોઈપણ ચાર) :

- (1) _____ ના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે.
(a) એડમ સ્મિથ (b) રોબિન્સ
(c) સેમ્યુલસન (d) કેઈન્સ
- (2) કિંમત ઘટતાં ગ્રાહકની વાસ્તવિક આવક _____.
(a) ઘટે છે (b) વધે છે
(c) સ્થિર રહે છે (d) આમાંથી કોઈપણ નહિ
- (3) પુરવઠાનું સંકોચન અને વિસ્તરણ એ પુરવઠામાં થતા _____ ફેરફારો છે.
(a) કિંમત પ્રેરિત (b) અન્ય પરિબળો પ્રેરિત
(c) કિંમત અને અન્ય પરિબળો પ્રેરિત
- (4) જો માંગમાં થતો વધારો પુરવઠામાં થતા વધારા કરતાં વધુ હોય તો કિંમત _____.
(a) ઘટે છે (b) વધે છે
(c) સ્થિર રહે છે
- (5) જો પુરવઠો સ્થિર રહે અને માંગ ઘટે તો કિંમત _____.
(a) ઘટે છે (b) વધે છે
(c) સ્થિર રહે છે
- (6) સિમેન્ટની માંગ એ _____ માંગનું ઉદાહરણ છે.
(a) સ્વતંત્ર (b) વ્યુત્પન્ન
(c) આવક (d) કિંમત
- (7) વિધાન 1 : મૂલ્યનો ખ્યાલ નિરપેક્ષ છે.
વિધાન 2 : કિંમતનો ખ્યાલ સાપેક્ષ છે.
(a) વિધાન 1 અને 2 બંને ખોટાં
(b) વિધાન 1 અને 2 બંને સાચાં
(c) વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું
(d) વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું
- (8) નાશવંત વસ્તુઓના કિસ્સામાં :
(a) જથ્થો > પુરવઠો (b) જથ્થો = પુરવઠો
(c) જથ્થો < પુરવઠો (d) આમાંથી કોઈ પણ નહિ

Seat No. : _____

MC-114

March-2022

B.A., Sem.-I (New)

CC-101 : Economics

(Elements of Economics – I)

Time : 2 Hours]

[Max. Marks : 50

PART – I

From the following eight questions, write the answer of any **three** questions :

1. Critically discuss welfare-oriented definition of economics given by Prof. Marshall. 14
2. What is meant by utility ? Explain in detail various characteristics and types of utility. 14
3. Explain the concept of demand function and discuss the determinants of demand. 14
4. Explain extension – contraction and increase – decrease of demand with the help of diagrams. 14
5. Explain the law of supply with the help of a diagram and discuss its exceptions. 14
6. What is supply ? Explain the concept of supply function and discuss various determinants of supply. 14
7. What is market ? Discuss various characteristics and functions of market. 14
8. What is market price ? Explain the determination of market price with the help of a schedule and a diagram. 14

PART-II

9. Multiple Choice Questions (any **four**) :

8

- (1) According to _____, economics is a Science of wealth.
 - (a) Adam Smith
 - (b) Robbins
 - (c) Samuelson
 - (d) Keynes
- (2) When price falls, consumer's real income _____.
 - (a) falls
 - (b) rises
 - (c) remains constant
 - (d) none of these
- (3) Extension and contraction of supply are _____ changes occurring in supply.
 - (a) price induced
 - (b) other factors induced
 - (c) price and other factors induced
- (4) If increase in demand is more than increase in supply, then price _____.
 - (a) falls
 - (b) rises
 - (c) remains stable
- (5) If supply remains stable and demand falls, then price _____.
 - (a) falls
 - (b) rises
 - (c) remains stable
- (6) The demand for cement is an example of _____ demand.
 - (a) autonomous
 - (b) derived
 - (c) income
 - (d) price
- (7) Statement 1 : The concept of value is absolute.
Statement 2 : The concept of price is relative.
 - (a) Statement 1 and 2 both false
 - (b) Statement 1 and 2 both true
 - (c) Statement 1 true and Statement 2 false
 - (d) Statement 1 false and Statement 2 true
- (8) In the case of perishable goods,
 - (a) Stock > Supply
 - (b) Stock = Supply
 - (c) Stock < Supply
 - (d) None of these